

સમાચાર પત્રોમાં જાહેરાત આપવા માટેનો મુસદ્દો



વડોદરા મહાનગરપાલિકા
બોરાક શાખા
જાહેર નિવેદન



ફુડ લાયસન્સ / રજીસ્ટ્રેશનની ઓનલાઇન અરજી માટે ફુડ બીઝનેસ ઓપરેટરોએ નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

STEP - 1 foscos.fssai.gov.in પર જઈ Login-Businesses માં Sign Up (Login ID, Password બનાવવા) ત્યારબાદ Username, Password, Captcha Code થી લોગીન કરી Apply for New License/Registration કરવું. (રાજ્ય ગુજરાત પસંદ કરવું)

STEP - 2 કાઇન્ડ ઓફ બિઝનેસ - KOB સિલેક્ટ કરવું (જે તે યોગ્ય ધંધાનો પ્રકાર જ પસંદ કરવો જેવા કે ઉત્પાદક/રીપેકર/કલબ-કેન્ટીન/ કેટેરર્સ/રેસ્ટોરન્ટ/હોટલ/સપ્લાયર/ડિસ્ટ્રીબ્યુટર/હોલ્સેલર/રીટેલર/હોકર્સ વિગેરે)

STEP - 3 તેમાં ટર્ન ઓવર સીલેક્ટ કરવું (હોકર્સ, રીટેલર વિગેરે કે જેઓનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૧૨ લાખથી ઓછું હોય તો તે [રજીસ્ટ્રેશન] ને પાત્ર થશે.) (મેન્યુફેક્ચરીંગ, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, કેટેરર્સ વિગેરે કે જેઓનું વાર્ષિક ટર્ન ઓવર રૂ/- ૧૨ લાખથી વધુ હોય તો [સ્ટેટ લાયસન્સ] ને પાત્ર થશે.)

STEP - 4 ત્યારબાદ ફોર્મ એ(રજીસ્ટ્રેશન)/ ફોર્મ બી(લાયસન્સ) માં જરૂરી વિગતો ભરવી જેમાં વડોદરા શહેર વિસ્તારમાં આવેલ પેઢી માટે ડીસ્ટ્રીક્ટ/સબ-ડીવીઝન ની વિગતમાં VADODARA MUNICIPAL CORPORATION સિલેક્ટ કરવું.

STEP - 5 ધંધાના પ્રકાર મુજબ Food Product Category પસંદ કરવું (પ્રોડક્ટ લીસ્ટની કેટેગરી તપાસવા માટે foscos.fssai.gov.in વેબસાઇટનાં હોમપેજ પર જઈને FSSAI Standardized Food Product અને Eligibility of your Food Business પર જઈને ચેક કરવું)

STEP - 6 ત્યારબાદ ફોર્મમાં માગ્યા મુજબની વિગતો ભરી, જરૂરી દસ્તાવેજો (foscos.fssai.gov.in વેબસાઇટનાં હોમપેજ ઉપર ધંધાના પ્રકાર મુજબ

Documents Requiredમાં દર્શાવ્યા પ્રમાણેના દસ્તાવેજો) Upload કરવાનાં રહેશે. તેમજ જેટલાં વર્ષ માટે લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવાં માગતાં હોય તે પસંદ કરી તેમાં દર્શાવેલી ફી ઓનલાઇન ભરવાની રહેશે. (લાયસન્સ માટે પ્રતિ વર્ષ રૂ/- ૨૦૦૦/- થી ૫૦૦૦/- ફી, ધંધાના પ્રકાર અને ક્ષમતા મુજબ અને રજીસ્ટ્રેશન માટે પ્રતિ વર્ષ ૧૦૦/- ફી રહેશે.)

લાયસન્સ/રજીસ્ટ્રેશન મહત્તમ ૫ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.

STEP - 7 ઓનલાઇન ફી ભરવા માટે પેમેન્ટ ઓપ્શન પસંદ કરી (ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ/નેટ બેંકીંગ/UPA થી ચુકવણી કરવાની રહેશે. ફી ભર્યા બાદ ઓનલાઇન રેસીપ્ટ જનરેટ થશે. foscos.fssai.gov.inનાં હોમપેજ પર Track Applicationથી રેફરન્સ નંબર આધારે આપ આપની અરજી ક્યા લેવલ પર છે, તે જોઈ શકશો.

*સદર ઓનલાઇ પ્રક્રિયામાં જો આપને કોઈપણ લેવલે મુશ્કેલી ઉભી થાય તો foscos.fssai.gov.in વેબસાઇટનાં હોમપેજ પર આવેલ યુઝર મેન્યુઅલ જુઓ. ટોલ ફ્રી નંબર 1800112100 અથવા helpdesk-foscos@fssai.gov.in પર સંપર્ક કરવો.

**વધુ માહિતી માટે વડોદરા મહાનગરપાલિકાનાં ડેઝીઝનેટેડ ઓફીસર અને અધિક આરોગ્ય અમલદારશ્રીની કચેરી નો સંપર્ક કરવો.

ટેલીફોન ફોન નં. ૦૨૬૫-૨૪૩૩૧૧૬/૨૪૩૩૧૧૮ (૨૯૨-ઇન્ટરકોમ)

Email-dooffice.vmc@gmail.com

વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in નાં Downloads માં Food Safety(License &Registration) Info. પર લાયસન્સ/રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની તમામ માહિતી સામેલ છે.

(લાયસન્સ/રજીસ્ટ્રેશન ની ઓનલાઇન પ્રક્રિયા ખુબજ સરળ છે.)

સ્વરૂપ પી. (I.A.S.)

પી.આર.ઓ.નં.૧૦૦૧ /૨૦૨૦-૨૧

મ્યુનિસિપલ કમિશ્નર